

B.Ed. Semester - 1 (CBCS) Examination
Oct/Nov. -2019 (NEW COURSE)
ACCOUNT (SELF STUDY COURSE)

Time: 1:15 Hours

Marks: 35

Instructions:

1. All questions are compulsory.
2. Figures to the right indicate marks.

પ્ર.૧ નીચેના પ્રત્યેક પ્રશ્નનો ટૂંકમાં ઉત્તર આપો.

૦૫

- ૧.૧ વ્યવહાર એટલે શું?
- ૧.૨ $A=C+L$ આ સમીકરણ સાચું છે કે ખોટું?
- ૧.૩ ખરીદ નોંધ એટલે શું?
- ૧.૪ રોકડમેળનો અર્થ આપો.
- ૧.૫ ખાતું એટલે શું?

પ્ર.૨ નીચેના પ્રશ્નોમાંથી કોઈપણ ૫ પ્રશ્નોના ઉત્તર આપો. (૬માંથી૫)

૧૦

- ૨.૧ નામની કોઈએક વ્યાખ્યા આપો.
- ૨.૨ કોઈ પણ ચાર પેટા નોંધના નામ આપો.
- ૨.૩ રોકડમેળના પ્રકારોના માત્ર નામ જણાવો.
- ૨.૪ ખાતાવહી એટલે શું??
- ૨.૫ કાચું સરવૈયું એટલે શું?
- ૨.૬ કાચું સરવૈયું તૈયાર કરવાની રીતના નામ આપો.

પ્ર.૩ નીચેના પ્રશ્નોમાંથી કોઈપણ ૫ પ્રશ્નોના વિસ્તૃત ઉત્તર આપો. (૬માંથી૫)

૨૦

- ૩.૧ ખાતાના ત્રણેય પ્રકાર માટે ઉધાર- જમાના નિયમો જણાવો
- ૩.૨ આમનોંધનો નમૂનો આપી, તેની સમજૂતી આપો.
- ૩.૩ જમાચિકીનો નમૂનો આપો.
- ૩.૪ પેટા નોંધના ફાયદા જણાવો.
- ૩.૫ કાચા સરવૈયાના કોઈપણ ચાર લક્ષણો સ્પષ્ટકરો.
- ૩.૬ રોકડમેલ અને પાસબુક પ્રમાણે બેન્કની બાકીમાં તફાવત આવવાના કારણો જણાવો.

ENGLISH VERSION

Q.1 Answer each of the following in brief.

05

- (1.1) What is Transaction?
- (1.2) $A=C+L$ is this equation right or wrong?
- (1.3) What is purchase book?
- (1.4) What is cash book?
- (1.5) What is account?

Q.2 Give answer of any 5 from the following .(5 out of 6)

10

- (2.1) Give definition of Accountancy.
- (2.2) Give any four name of subsidiary books.
- (2.3) Give name of the types of cash book.
- (2.4) What is ledger?
- (2.5) What is Trial balance?
- (2.6) Name the method for preparing trial balance.

Q.3 Answer any 5 from the following 6 in detail.

20

- (3.1) Mention the rules for credit and debit the account for all three types of account.
- (3.2) Explain journal with specimen.
- (3.3) Give specimen of credit note.
- (3.4) Mention advantages of subsidiary books.
- (3.5) Explain any four characteristics of trial balance. .
- (3.6) Explain the causes of difference between bank balance as per cashbook and passbook.
